

## બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે "ક્વોરન્ટીન ટોક્સ" યોજાયો

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ના આઇ. ઇ.આઇ (મિકેનિકલ તથા પ્રોડક્શન) બ્રાન્ચ તથા ગવર્નમેન્ટ તા.22 મે થી 27 મે દરમિયાન "ક્વોરન્ટીન ટોક્સ" નું આયોજન કરવામાં આવ્યું જેમાં બી.વી.એમ કોલેજ માંથી ઉત્તીર્ણ થયેલા અને દેશ વિદેશ માં ખ્યાતનામ જગ્યા એ કાર્ય કરતા જુદા જુદા ક્ષેત્ર નાં તજજ્ઞો ને વક્તા તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય સરદાર પટેલ,ભાઇકાકા,ભીખાભાઇ ના માર્ગદર્શન તથા શ્રી ઘનશ્યામદાસજી બિરલા ના અનુદાન હેઠળ સ્થપાયેલી રાજ્ય પ્રથમ એન્જીનીયરીંગ કોલેજ બી.વી.એમ ના **20000** થી વધારે એન્જીનીયર્સ સમગ્ર વિશ્વ માં કાર્યરત છે."*Once a BVMITE always a BVMITE*" ને કેન્દ્ર માં રાખી ને બીવીએમ ના એન્જીનીયર્સ બી.વી.એમ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે જે સંસ્થા માટે ગૌરવપૂર્ણ બાબત છે."ટુ પ્રોડ્યુસ ડ્લોબલી એમ્પ્લોયેબલ ઇનોવેટિવ એન્જીનીયર્સ વિથ કોર વેલ્યુઝ " વિઝન પર કાર્યરત બી.વી.એમ ના વિદ્યાર્થીઓ માટે ક્વોરન્ટીન ટોક્સ પ્રેરણા દાયી નીવડે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉપરોક્ત ક્વોરન્ટીન ટોક્સ નો મૂળભૂત ઉદ્દેશ્ય બીવીએમ ના વિદ્યાર્થીઓ ને તેમની આગામી કારકિર્દી લક્ષ્યાંકો સિદ્ધ કરવાં માટે ઉપયોગી નીવડે તેવી શુભેચ્છા મિકેનિકલ એન્જી ના વડા ડૉ.પી.એમ.જ્યોર્જ વ્યક્ત કરી હતી.પ્રો.ભરત પટેલ (Faculty Adviser,I.E.I Mechanical Enggg. student chapter) તથા બી.વી.એમ ના વિદ્યાર્થીઓ એ ક્વોરન્ટીન ટોક્સ ને સફળ બનાવવા ઉત્સાહપૂર્વક કામગીરી હાથ ધરી હતી.આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ શુભેચ્છા વ્યક્ત કરી હતી

પ્રથમ દિવસે મિતાલી રાવલ કે જેઓ ફિલાંસ રાઇટર છે તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને સમજાવ્યું કે આજ ના સમય માં વિદ્યાર્થીઓને રોજગારી ની તક મેળવવા માટે "લિંક્સ ઇન" વેબસાઇટ નો ઉપયોગ કરવો શા માટે જરૂરી છે.



તા.23 ના રોજ અમેરિકાથી નિસર્ગ પટેલ વિદ્યાર્થીઓ સાથે જોડાયા જેઓ હાલ ત્યાંની ખ્યાતનામ કંપની "વોલમાર્ટ" માં પ્રોડક્ટ મેનેજર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રોડક્ટ મેનેજમેન્ટ ના પાયાના સિદ્ધાંતોસમજાવ્યા તથા વિદેશ માં અનુસ્નાતક ડિગ્રી ના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.

તા.24 ના રોજ અમેરિકાથી જીગર પટેલ જોડાયા કે જેઓ ત્યાંની "મિડ માર્ક" કંપની માં ટેસ્ટ એન્જિનિયર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને અમેરિકાની કંપની માં ચાલી રહેલી મેન્યુફેચરિંગ પદ્ધતિઓ વિશે માહિતી આપી તથા તે બાબતે વિદ્યાર્થીઓના પ્રશ્નો નો ઉકેલ કર્યો.





તા. 25 ના રોજ ખાસ મહેમાન "દર્શન શાહ" એ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા કે જેઓ હાલ આણંદ ના "ડેપ્યુટી કલેક્ટર" તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે 2014 માં બિવિએમ માંથી ઇ.સી. ઇજનેરી અભ્યાસ પૂર્ણ કર્યો અને હાલ દેશસેવા ના કાર્ય માં જોડાયેલા છે. તેમણે કોરોના વાઇરસ માટે સરકાર એ લીધેલા તમામ પગલાં ના કારણો સમજાવ્યા તથા તંત્ર આ મહામારી સામે કઈ રીતે લડી રહ્યું છે તેની વિસ્તૃત માહિતી આપી. ઉપરાંત આ બાબતે લોકો ના તમામ પ્રશ્નો ના ઉકેલ આપ્યા.

તા. 26 ના રોજ દિપેન ભિલા નામક વક્તા જોડાયા જેમણે વિદ્યાર્થીઓને ભણાતર સાથે જીવન માં ઈતર પ્રવૃત્તિ ના મહત્વ વિશે વાત કરી. કોલેજ કાળ દરમિયાન તેઓ એ ઈતર પ્રવૃત્તિ માં ખાસ રસ કેળવ્યો અને હાલ પ્રોફેશનલ ઇવેન્ટ પ્લાનર તરીકે કાર્ય કરી રહ્યા છે.



કાર્યક્રમ ના અંતિમ દિવસે વરુણ દવે કે જેઓ ગોદરેજ કંપની માં હાલ ઇન્ટર્નશીપ કરી રહ્યા છે અને ઘણા સફળ ઇન્ટરવ્યુ માંથી પસાર થઈ ચુક્યા છે એમણે પ્લેસમેન્ટ તથા ઇન્ટરવ્યુ સફળતાપૂર્વક પસાર કરી ને સારી નોકરી કઈ રીતે મેળવવી તેના માટે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું.

આ સમગ્ર "કવોરેન્ટીન ટોકસ" ને IETI TEAM BVM નામક યુ ટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ મુકવામાં આવ્યો હતો.



**THE INSTITUTION OF ENGINEERS (INDIA)**  
MECHANICAL & PRODUCTION CHAPTER  
**BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA**



**Mitali Raval**  
Freelance writer &  
Content Creator



**Mr. Darshan Shah**  
Deputy Collector, Anand



**Mr. Dipen Bhila**  
Event Planner



**Mr. Jigar Patel**  
Test Engineer, Midmark  
Corporation, USA



**Mr. Varun Dave**  
Pursuing MBA, SIBM Pune  
Summer Intern at  
Godrej Consumer Products Limited



**Mr. Nisarg Patel**  
Product Manager, walmart  
USA

22<sup>nd</sup> to 27<sup>th</sup> May 2020

on

**IEI TEAM BVM**



[ieimepr@bvmengineering.ac.in](mailto:ieimepr@bvmengineering.ac.in)

[ieiteambvm](https://www.instagram.com/ieiteambvm)

Prof. Mayur M. Sevak  
Print Media Coordinator  
B.V.M Engineering College  
+917575884675